

પાનખરે વસંતની લહેર ...

યુગ પલટાયો છતાં, સ્ત્રીને આજે પણ વધતા ઓછા પ્રમાણમાં પીતા, પતી અને પુત્રના અંકુશ હેઠળ જીવનું પડે છે.

પ્રેમાળ, સમજુ, પીતા, પતી, પુત્ર મળે તો આ અંકુશનો એને અહેસાસ થવા દેતા નથી, પણ અંકુશ નેપથ્યે તો હોય જ છે. આ બંધનમાં કુનેહભરી રીતે જીવી જાણવું એ સ્ત્રીની આગવી સુજાની બાબત છે.

ખાસ કરીને તેના જીવનની પાનખરે, જ્યારે પુત્ર પોતાના કુટુંબમાં ગરકાવ થઈ ગયો હોય ત્યારે, “મા” એમાં “બોજારૂપ” “બંધનરૂપ” જણાય છે. આવે વખતે સ્ત્રીએ સ્વેચ્છાએ દુર ખસી, પોતાની આગવી પ્રવૃત્તિ વીકસાવી, અન્યની અપેક્ષારહીત જીવન જીવનું.

પુત્ર મુર્કેલીમાં હોય, મુંજાયેલો હોય, એને સહાયની જરૂર હોય તો બધી જ પ્રવૃત્તિ દુર હહસેલી હાજર થઈ જવું, બાકી કોઈ બાબતમાં માથું નહી મારવું. અનુભવોની વણારમાંથી પ્રાપ્ત થયેલી ઉંડી સુજસમજની જો પુત્ર કદર કરે અને સલાહ માગો તો જરૂર આપવી બાકી વણમાગી સલાહ કે અભીપ્રાય ક્યારેય રજુ નહીં કરવાં.

ગમે તેટલી સધર આથીક વ્યવસ્થા કરી હોવા છતાં, પાનખરના કોઈક તબક્કે તો કટોકટી જણાશે જ, તો આ કપરા કાળ માટે

pa'nhkhare vasantni laher...

yug palt'a'yo ch'ata', strine a'je pan' vadhata' och'a` prama'n'ma' pita', pati ane putrana' ankush herth'al' jivavu pad'e ch'e.

prema'l', samaju, pita', pati, putra mal'e to a' ankushno ene ahesa's thava' deta' nathi, pan' ankush nepathye to hoy j ch'e. a' bandhanma' kunehbhari rite jivi ja'n'vu e strini a'gavi suzni ba'bat ch'e.

kha's karine tena' jivanni pa'nhkhare, jya're putra pota'na' kut'umbma' garka've thai gayo hoy tya're, "ma'" ema' "boja'rups" "bandhanrup" jan'a'y ch'e. a've vakhate strie svechch'a'e dur khasi, pota'ni a'gavi pravrutti vikasa'vvi, anyani apexa'rahit jivan jivvu.

putra mushkelima' hoy, munza'yelo hoy, ene saha'yni jarur hoy to badhi j pravrutti dur had'aseli ha'jar thai javu, ba'ki koi ba'batma' ma'thu nahi ma'rvu. anubhavoni van'za'rma'thi pra'pt thayeli und'i suz-samajni jo putra kadar kare ane sala'h ma'ge to jarur a'pavi ba'ki van'ma'gi sala'h ke abhipra'y kya'rey raju nahi karava'.

game tet'ali a'rthik sadhdhar vyavastha' kari hova' ch'ata', pankharna' koik tabakke to kat'okat'i jan'a'she j, to a' kapara' kal' ma't'e

આગમચેતી વાપરી પહેલેથી જ બચત કરવી. શક્ય હોય ત્યાં સુધી પુત્ર પાસેથી આર્થિક અપેક્ષા નહીં રાખવી.

પરીવાર, મીત્રવર્ગ, સમાજ દરેકને ઉપયોગી બની જીવી જાણવું. ક્યારેય “બીચારા” કે “દ્યાપાત્ર” નહીં બનવું, સ્વાવલંબી બની પારકાની સેવા કરતા રહેવું, જેથી બધે આવકારપાત્ર બનાય. નહીં તો સ્વજનો પણ બોજારુપ ગણી તરછોહશે. ખોટી લાગણીનાં પુરમાં કદી તણાવું નહીં. જાહી ચામડીના બની, નીજાનંદમાં હુબી, સેવામય, નીઃસ્પૃહ જીવન અપનાવી, સંજોગ સાથે સમાધાન કરી લેવું. હગલે ને પગલે જો અપમાન, ઉપેક્ષા, ઉદ્ધતાઈ, તોછાઈના કરવા ધૂંટરા પીવાનો વારો આવે તો નીલકંઠ બની જઈ હસતે મોઢે તે પી જવા. વીષમતામાં સમતા કેળવવી, સહીષ્ણુ બની, મીજાજ કાબુમાં રાખી, મીતભાષી બની જવું. પોતાનાં દુઃખ પોતાનાં દીલમાં જ સમાવી દેવાં. ભુતકાળમાં કરેલ ઉપકારો ભુલથી પણ ક્યારેય યાદ ન કરવા કારણ કે, તે યાદો અત્યંત દુખદાયી પુરવાર થશે.

જીવનનો આ સૌથી કપરો કાળ, જ્યારે ગાત્રો શીથીલ બની જાય, નેત્રો ઝાંખ્યું અનુભવે, જ્યારે દીલ પ્રેમ, સહકાર, આધાર માટે સૌથી વધુ તહ્યે ત્યારે જ તે બધા વગર જ જીવતાં શીખી જવું.

આવે વખતે ફક્ત બીજાના ગુણ જ જોવાની દસ્તી કેળવવી અને જો કોઈ નીર્ગુણ જ

agamcheti va'pari pahelethi j
bachat karavi. shakya hoy tya'n
sudhi putra pa'sethi
a'rthik apexa' nahi ra'khavi.

pariva'r, mitravarg, sama'j
darekne upayogi bani jivi
ja'n'vu. kya'rey "bicha'ra"" ke
"daya'pa'tra" nahi banavu,
sva'vambi bani pa'rka'ni seva'
karta' rahevu, jethi badhe
a'vka'rpa'tra bana'y. nahi to
svajano pan' boja'rups
gan'i tarach'od'she. khot'i
la'gan'ina' purma' kadi tan'a'vu
nahi. ja'd'i cha'mad'ina' bani,
nija'nandma' d'ubi, seva'may,
nihispruh jivan apana'vi, sanjog
sa'the sama'dha'n kari levu.
d'agale ne pagale jo apama'n,
upexa', uddhata'i, toch'ad'a'ina'
kad'ava' ghunt'ad'a' piva'no va'ro
a've to nilkanth' bani jai haste
mod'h'e te pi java'. vishamta'ma'
samta' kel'avvi, sahishn'u bani,
mija'j ka'buma' ra'khi, mitbha'shi
bani javu'. pota'na' dukh pota'na'
dilma' sama'vi deva'. bhutka'l'ma'
krela' upaka'ro bhulthi pan' kya'rey
ya'd na karava' ka'ran' ke, te
ya'do atyant dukhada'y i purva`r
thashe.

jivanno a' sauthi kaparo ka'l', jya're
ga'tro shithil bani ja'y, netro
za'nkhap anubhave, jya're dil prem,
sahaka'r, a'dha'r ma't'e sauthi vadhu
tad'ape tya're ja te badha' vagar
j jivata' shikhi javu.

a've vakhate fakta bija'na' gun' j
jova'ni drusht'i kel'avvi ane jo koi
nirgun' j

હોય તો, તે તરફ દુર્લક્ષ કરી, ઉપેક્ષા સેવી, અંશાનુબંધ સ્વીકારી, અલીપ્ત થઈ જવું. તો જ જીવનમાં શાંતી પ્રાપ્ત થશે.

આ બધું એક માનવનું નહીં પણ; કદાચ એક “મહામાનવ”નું કામ છે. ક્યારેક તો સહીષ્ણુતાનો બંધ તુટી પડશે, અને મન ભાંગી પડશે પણ તે વખતે આત્મામાં લીન થઈ જઈ, પરમાત્માનો સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરવો.

ઘરના કોઈક અંધારા ખુણે એકાંતે બેસી આંસુ સારી લેવાં. વરસાએ વરસી ગયા પછી, કાળાં ઊભાંગ વાદળો હઠી જાય છે અને નભ ફરી એકવાર સ્વરષ્ટ બની જાય તેવી રાહતનો અહેસાસ થશે અને જીવનની પાનખરે પણ વસંતની લહેર અનુભવાશે.

લેખક: “અનંત”

૬ નવેમ્બર ૨૦૦૦ના “ગુજરાત સમાચાર”
દૈનિકમાંથી : ઉત્તમ જોહરીમાં અને વીજયા-
કલાપી ફેન્ટ્માં પુનર્લેખન :
uttamgajjar@hotmail.com

hoy to, te taraf durlax kari, upexa sevi, run'a'nubandh svika'ri, alipta thai javu. to ja jivanma' sha'nti pra'pt thashe.

a' badhu ek ma'navnu nahi pan'; kada'ch ek "maha'ma'nav"nu ka'm ch'e. kya'rek to sahishn'utano bandh tut'i pad'ashe, ane man bha'ngi pad'ashe pan' te vakhate a'tma'ma' lin thai jai, parma'tma'no saxa'tka'r karava' prayatna karvo.

gharna' koik andha'ra' khun'e eka'nte besi a'nsu sa'ri leva'. varsa'd varsi gaya' pach'i, ka'l'a' d'iba'ng va'dal'o hat'i ja'y ch'e ane nabh fari ek va'r svachch'a bani ja'y tevi ra'hatno ahesa's theshe ane jivanni pa'nkhare pan' vasantni laher anubhava`she.

lakhak: “Anant”

6-November 2000na'
"Gujra't Sama'cha'r" dainikma'thi
'eBha'rti'-Romanized Gujra'tima'
punarlekhan:
uttamgajjar@hotmail.com

SURAT-July 31, 2005